

Seat No. : _____

NB-105

December-2015

B.Sc., Sem.-V

Core Course-301 : Chemistry (Organic Chemistry)

Time : 3 Hours]

[Max. Marks : 70

- સૂચના : (1) બધા પ્રશ્નોના ગુણા સરખા છે.
(2) જમણી બાજુએ દર્શાવેલ અંક પેટા પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.

1. (A) નીચેના પ્રશ્નોના જવાબ આપો :

7

- (i) સ્પાયરેન સંયોજનોની પ્રકાશ સમઘટકતા ચર્ચો.
(ii) કિરાલીટીનો ગુણ ન હોવા હતાં શા માટે એલિન્સ વ્યુત્પન્નો પ્રકાશ કિયાશીલ બને છે ? સમજાવો.

અથવા

ડાયફિનાઈલ્સમાં કયા સ્થાને કેવા પ્રકારના સમૂહો ગોઠવવામાં આવે તો તે પ્રકાશ કિયાશીલ બનશે ? ઉદાહરણો આપી સમજાવો.

- (B) E2 સીન (syn) વિલોપન પ્રક્રિયા બે ઉદાહરણ આપી સમજાવો.

7

અથવા

સીસ-3-હેક્ઝિનની બ્રોમીન (Br_2) સાથેની યોગશીલ પ્રક્રિયાથી મળતી નીપજો દર્શાવો તથા તેની કિયાવિધિ સમજાવો.

2. (A) નીચેના પ્રક્રિયકની સાંશ્લેષિત ઉપયોગીતા કિયાવિધિ આપી સમજાવો :

7

- (i) એલ્યુમિનિયમ આઈસો પ્રોપોક્સાઈડ
(ii) ઓર્સિમયમ ટેટ્રોક્સાઈડ (OSO_4)

અથવા

- (i) લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રોઈડ
(ii) લેડ ટેટ્રા એસિટેટ

- (B) નીચેની પ્રક્રિયાનો સિક્ષાંત, કિયાવિધિ અને સાંશ્લેષિત ઉપયોગીતાઓ સમજાવો :

7

બર્ચ રિડક્શન અથવા ફાઈજ પુનર્ચના

3. (A) નીચેના પ્રશ્નોના જવાબ આપો :

8

- (i) SN^1 પ્રક્રિયાનું અવકાશ રસાયણ ચર્ચો.
(ii) E1CB પ્રક્રિયાની કિયાવિધિ સમજાવો અને તેની મર્યાદાઓ લખો.

અથવા

- (i) વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પર નોંધ લખો.
(ii) કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં દ્રાવક તથા બેઇઝની અસર સમજાવો.

- (B) નીચેના પ્રશ્નનો જવાબ આપો : 6
 2, 4-ડાયનાઈટ્રોક્લોરોબેન્જિન 170 °C તાપમાને NH₃ સાથે 2, 4-ડાયનાઈટ્રોએનિલીન આપે છે. આ પ્રક્રિયા કિયાવિધિ આપી સમજાવો.
અથવા
 0-બ્રોમો ઓનિસોલ અને m-બ્રોમો એનિસોલ સોડામાઈડ સાથે પ્રવાહી એમોનિયાની હાજરીમાં ફક્ત એક જ નીપજ આપે છે સમજાવો.
4. (A) (+)-લેક્ટોજનું બંધારણ પુરવાર કરો. 6
- અથવા**
 (+)-સેલોબાયોજમાં C₁ – C₄ બંધ પુરવાર કરતી પ્રક્રિયાઓ ચર્ચો.
- (B) સંશ્લેષણ આપો : 8
 (i) ઘૂરીન (ii) સાયટોસીન (iii) જવાનીન
અથવા
 (i) એનીન (ii) યુરેસીલ (iii) પિરીમીડીન
5. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો : 14
- (1) કોન્ફિગ્યુરેશનલ (configurational) સમઘટકોના ક્યા-ક્યા પ્રકાર છે ?
 - (2) અણુ અસમ બનવા માટે કઈ-કઈ શરતો હોવી જરૂરી છે ?
 - (3) 1-બ્રોમો-1, 2-ડાયફિનાઈલ પ્રોપેનના ઇરિથ્રો (Erythro) અને થ્રીયો (Threo) સ્વરૂપો દર્શાવો.
 - (4) આદમ્સ ઉદ્વિપકના કોઈપણ બે ઉપયોગ લખો.
 - (5) ફ્યુરાનની મેલિક (Maleic) એનહાઈટ્રોઈડથી મળતી યૌગિક નીપજ (Adduct)નું સમીકરણ લખો.
 - (6) વુલ્ફ પુનર્જના કોને કહે છે ?
 - (7) હોફ્મેન પ્રક્રિયાનો સિદ્ધાંત લખો.
 - (8) આલ્કીલ હેલાઈડની સાપેક્ષમાં મસ્ટાઈ વાયુના જળવિભાજનનો વેગ લાખો ગણો વધારે જોવા મળે છે તે સમીકરણ દ્વારા સમજાવો.
 - (9) નિયો પેન્ટાઈલ બ્રોમાઈડ પ્રાથમિક આલ્કીલ હેલાઈડ હોવા છતાં SN² પ્રક્રિયા આપતો નથી. શા માટે ?
 - (10) એરાઈલ અને વિનાઈલ હેલાઈડની કેન્દ્રાનુરાગી એરોમેટીક વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી હોય છે. શા માટે ?
 - (11) O-ડયુટેરોફ્લોરો બેન્જીનની NH₃ની હાજરીમાં NH₂[⊖] આયન (amide ion) સાથેની પ્રક્રિયામાં મુખ્યત્વે કઈ નીપજ મળે છે ? શાથી ?
 - (12) સુકોજનું બંધારણ લખો.
 - (13) માલ્ટોઝ તથા સુકોજનું જળવિભાજન ક્યા-ક્યા ઉત્સેચક દ્વારા થાય છે ?
 - (14) ઘૂરીનના વિવિધ સ્વરૂપો દર્શાવો.

NB-105

December-2015

B.Sc., Sem.-V

Core Course-301 : Chemistry (Organic Chemistry)

Time : 3 Hours]

[Max. Marks : 70

Instructions : (1) All questions carry equal marks.

(2) Figures to the right indicate full marks of the sub-questions.

1. (A) Answer the following questions :

7

(i) Discuss the optical isomerism of Spiran compounds.

(ii) Why Allene derivatives become optically active though they do not possess chirality ? Explain.

OR

At which place and of what type of substitution will make diphenyl optically active. Explain giving examples.

- (B) Explain E2 syn-elimination by giving two examples.

7

OR

Explain with mechanism, the products obtained by the addition of Bromine (Br_2) to cis-3-Hexene.

2. (A) Discuss the synthetic applications of the following reagents with mechanism.

7

(i) Aluminium isopropoxide

(ii) Osmium tetroxide (OSO_4)

OR

(i) Lithium aluminium hydride

(ii) Lead tetra acetate

- (B) Discuss the principle, mechanism and synthetic applications of the following reaction.

7

Birch Reduction

OR

Fries Migration

3. (A) Answer the following questions :

8

(i) Discuss the stereochemistry of SN^1 reaction.

(ii) Explain E1CB reaction mechanism and give its limitations.

OR

(i) Note on Substitution V/s. Elimination.

(ii) Explain the effect of solvent and base on nucleophilic substitution reaction.

(B) Answer the following questions : 6

2, 4 – Dinitro chlorobenzene with NH_3 at $170\text{ }^\circ\text{C}$ temperature gives 2, 4 – Dinitroaniline. Explain by giving mechanism.

OR

Both o-bromo anisole and m-bromo anisole give only one product with sodamide in presence of liquid ammonia. Explain.

4. (A) Prove the structure of (+) Lactose. 6

OR

Discuss the reaction which proves the $\text{C}_1 - \text{C}_4$ linkage present in (+) cellobiose.

(B) Give synthesis of the following : 8

- (i) Purine
- (ii) Cytosine
- (iii) Guanine

OR

- (i) Adenine
- (ii) Uracil
- (iii) Pyrimidine

5. Answer the following objective questions : 14

- (1) Mention various types of configurational isomers.
- (2) What are the conditions required to make a molecule chiral ?
- (3) Draw the erythro and threo form of structure of 1-bromo – 1, 2 – diphenyl propane.
- (4) Give any two uses of Adam's catalyst.
- (5) Write the equation of reaction between furan and maleic anhydride and mention the product (adduct)
- (6) Define Wolf rearrangement.
- (7) Give the principle of Hoffmann reaction.
- (8) Explain with equation why the rate of hydrolysis of mustard gas is millions times faster than alkyl halide.
- (9) Why Neo-pentyl bromide does not undergoes SN^2 reaction inspite of primary alkyl halide ?
- (10) Why aromatic nucleophilic substitution reaction of aryl and vinyl halide is very slow ?
- (11) Which is the main product of the reaction between O-deuterofluorobenzene with NH_2^\ominus (amide ion) in presence of ammonia ? Why ?
- (12) Give the structural formula of Sucrose.
- (13) Mention the enzymes used in the hydrolysis of Maltose and Sucrose.
- (14) Give the various forms of purine.